

Date: 03rd August, 2022

Date: USia August = 1	
The Manager,	
BSE Limited,	
PhirozeJeejeebhoy Towers	
'A' wing,	
Dalal Street, Fort,	
Mumbai - 400021	2045

Subject: Annoucement under Regulation 30 of SEBI(LODR) regulation 2015-Newspaper clippings- Notice to the shareholders of 30th Annual General Meeting along with Remote E-voting Information and Book Closure Reference:Scrip Code -541503; ISIN - INE250G01010; SYMBOL: UNICK

Dear Sir/Madam,

& Disclosure (Listing Obligations Requirements)Regulations, 2015, we are enclosing herewith the copy of newspaper 30 of SEBI Pursuant to clippings of Notice of the shareholders of 30^{th} Annual General Meeting along Remote Evoting information and Book Closure published in Western Times (Gujarati) Ahmedabad Morning Edition, Western Times (English) Ahmedabad Morning Edition newspaper on Monday 01st August, 2022.

This is for your information and record.

Thanking you, Yours faithfully

For Unick Fix-a-form & Printers Limited

CHANGODA

Astha Pandey Company Secretary

Enc: As above

June trade deficit widens to record \$26.1 billion

chandise trade deficit widened to a record \$26.18 billion in June, wider than the government's earlier estimate of \$25.63 billion, after the Commerce Ministry revised upwards both the exports and imports figures for the month.

While goods exports increased 23.5% year-onyear in June to exceed \$40.1 billion (preliminary estimate was \$38 billion), imports outpaced, surging 57.5% to \$66.3 billion on the back of higher pur-chases of coal, gold and petroleum products.

trade deficit was \$24.3 billion in May. Last month's trade deficit was almost three times as wide as the \$9.6 billion shortfall recorded in June 2021.

The surge in imports was driven by coal, gold and petroleum products as estimated earlier, but there were significant upward revisions for each. Coal imports jumped almost fourfold to \$6.76 billion while gold imports almost trebled to surpass \$2.7 billion. Petroleum imports climbed 99.5% to \$21.3 billion.

roleum products. Excluding petroleum
The previous record and gems and jewellery,



imports were up 38.3% at \$38.53 billion in June. Stripping out the same product categories from the export data, meant exports of other products grew by a single digit of 8.65% to

economic climate where

the impact of global eco-

nomic headwinds on the

Indian economy is yet to

side stakeholders remain

watchful of the tripartite

global risks - economic tur-

moil in the United States,

Russia - Ukraine standoff,

and economic slowdown

in Europe, Knight Frank said.

revealed while the devel-

opers' future sentiment

score increased during the

quarter, non-developers'

Despite the rising cost pressures and home loans becoming expensive, the optimism amongst devel-

opers is on the account of a

strong demand trend from

homebuyers, the consult-

score declined.

Interestingly, the study

The real estate supply-

play out.

about \$28 billion. In the export basket, engineering goods and drugs and pharmaceuticals, that were earlier estimated to have recorded declines, actually clocked

shipments, respectively. Petroleum exports were up 119% at \$8.6 bil-

lion, while electronic goods' exports jumped 60.7% to \$1.67 billion. Rice exports some days to cross the \$1 billion mark, while the employment-intensive readymade garments sector clocked a 50% uptick in exports. Cotton yarn and handloom products, as well as plastic and linoleum, that are among India's top 10 export commodities, contracted 19.5% and 20%, respectively. The first quarter of 2022-23 thus witnessed a 24.5% rise in goods ex-

while imports rose 49.5% to \$189.76 billion. The trade deficit for the quarter widened to \$70.8 billion. While the upwardly revised merchandise trade deficit for June 2022 poses some upside risks to the current account deficit for the first quarter the correction in commodity prices has softened the outlook for the ongoing quarter," said ICRA chief economist Aditi Nayar. However, she cautioned that export growth may undergo a slowdown amidst a weaker outlook for the global economy.

Sentiments in real estate sector dip in June quarter but remain positive

ment index for the real estate sector dropped in April-June period due to two rounds of reporate hike but remained positive, according to Knight Frank India and NAREDCO.

The outlook for next six months is optimistic although not as buoyant as it was during the March quarter. As per the Knight Frank-NAREDCO Real Estate Sentiment Index Q2 (April-June 2022), the current sentiment score has moderated to 62 from record 68 reported in January-March.

The sentiment index is based on the survey of supply-side stakeholders like developers, investors and financial institutions. The score of above 50 indicates 'optimism' in sentiments, a score of 50 means the sentiment is 'same' or 'neutral'. The score below 50 indicates 'pessimism'.

The current sentiment index score has dropped mainly due to the perceived impact of the two consecutive repo rate hikes in May



The future sentiment score, which captures the stakeholder sentiments for the next six months for the real estate sector, also shrunk to 62 in Q2 2022 from its historic high of 75 in Q1 2022, as pressures of a rise in inflation and depreciating rupee against the dollar cast a shadow on the sector, the consultant said.

Despite the decline, both the current and future sentiment scores remained optimistic, it added. In Q2 2022, the Current Sentiment Index score and **Future Sentiment Score are** equal as stakeholders are

confounded in the current

IndusInd Bank Q1 net up 64% to Rs 1,603 cr
ai: IndusInd Bank's nual growth ra

reported a 64.4 per cent year-on-year rise in its standalone net profit to Rs 1,603.29 crore during Q1FY23, led by a healthy increase in net interest income. The private sector lender had reported a profit after tax of Rs 974.95 crore in the first quarter of the previous financial year. Sequentially, IndusInd Bank's net profit rose 17.8 per cent from Rs 1,361.37 crore in

January-March. During the quarter gone by, the private bank's net interest income registered 16 per cent YoY growth to Rs 4,215 crore. The net interest income the difference between the interest earned and interest expended rose 4 per cent se-

quentially. IndusInd Bank's net interest margin clocked in at 4.21 per cent for the period under review, against 4.06 per cent a year ago, and 4.20 per cent in January-March.

In April-June, the bank's other income was at Rs 932 crore, 12 per cent higher than Rs 723 crore a year ago. Core fees grew 47 per cent YoY to Rs 786 crore, from Rs 214 crore a year ago. As on deposits were at Rs 3.02 trillion, 13 per cent higher than Rs 2,67 trillion a year ago.

Current Account Savinas Account (CASA) deposits, which are low-cost deposits, rose to Rs 1.30 trillion (as on June 30), with the share of current account deposits at Rs 35,265 crore and that for savings accounts at Rs 95,243 crore.

CASA deposits comprised 43 per cent of total deposits as on June 30, the bank said. The bank's advances stood at Rs 2.47 trillion, 18 per cent higher than

Rs 2.10 trillion a year ago. On the bank's guidance for 4.15-4.25 per cent net interest margin, Managing Director and Chief Execu-tive Officer Sumant Kathpalia said in an earnings call that the bank was confident of delivering on that range for the year, even as deposit rates are on the rise amid the Reserve Bank of India's monetary tightening cycle. Our asseť míx is such that we should be able to

manage the NIM, he said. On the credit front, Kathpalia said that while the bank's guidance is for a 16-18 per cent compound an(CAGR), the bank is aiming for a 20 per cent CAGR in the current year, so as to "catch up" from 12 per cent in the previous year.

IndusInd Bank sees opportunities from the RBI's recent relaxations on nonresident external account deposits and is trying to garner more NRE deposits,

Kathpalia said. The RBI said that beginning July 30, banks do not have to maintain CRR (cash reserve ratio) and SLR (statutory liquidity ratio) on incremental deposits flowing into FCNRB (foreign currency non-resident bank) and NRE deposits. The relax-ation shall be applicable for deposits mobilised. We do not give numbers on NRE deposits we are assessing the market and we should be able to get it, Kathpalia said. We have a large FX book and can convert to local currency with the swap cost, and it will still be cheaper than what we get in the domestic market. Right now, we believe that we have the right rates our rates will be 50-75 bps higher than the market and

that's where we will be.

BIZ NEWS IN NUTSHELL

Hyundai Motor names new CEO for US operations

Seoul, (IANS) Hyundai Motor, South Korea's biggest carmaker, said on Friday it has named a new chief executive for its US operations amid the prolonged chip shortage. Hyundai has promoted Randy Parker to be CEO of Hyundai Motor America, effective from August 1. He will be in charge of Hyundai's commercial automotive operations in the US market, the company said in a statement. Parker will report to Jose Munoz, president and CEO of Hyundai Motor America, reports Yonhap news agency. "Randy is the perfect person to continue Hyundai's recent successes in sales, market share and growth in the US," Munoz said. In May 2019, Parker was named vice president of national sales at Hyundai Motor America and was promoted to senior vice president in February 2021. During his tenure, Hyundai became one of the fastest growing mainstream brands in the world's most important automobile market, achieving record retail sales in 2021. Hyundai's U.S. sales jumped 19 per cent to 738,081 vehicles in 2021 from 622,269 units a year earlier.

Yes Bank to form ARC with JC Flowers to sell Rs48,000 cr. of bad loans

New Delhi: Yes Bank has selected JC Flowers ARC as partner to form an asset reconstruction company to sell bad loans of the bank valuing Rs48,000 crore. The lender said it had signed a binding term sheet with JCF ARC LLC and JC Flowers Asset Reconstruction Pvt. Ltd. (JF Flowers ARC) for strategic partnership in relation to sale of identified stressed loans of the bank. Having subsequently fulfilled the requisite preconditions, the term sheet had become effective from July 15, 2022, Yes Bank said in a regulatory filing. Accordingly, the bank has decided that JC Flowers ARC will be base bidder for a proposed sale of an identified stressed loan portfolio of the bank aggregating to up to Rs48,000 crore, it said. As per Reserve Bank of India guidelines, Yes Bank said it proposed to run a transparent bidding process on Swiss Challenge basis for sale of such portfolio using JC Flowers ARC's bid as the base bid.

Mindtree net rises 37% to Rs471.6 crore in April-June

New Delhi: IT company Mindtree posted a 37.3% rise in net profit to Rs471.6 crore for the three months ended on June 30. The company had reported a net profit of Rs343.4 crore in the corresponding quarter of the previous fiscal. The revenue for the current fiscal's first quarter came in at Rs3,121.1 crore, log-ging a growth of over 36% year-on-year. We are excited to report a strong start to FY23 with robust revenue growth, solid margin and a record order book, demonstrating our continued industry-leading growth momentum, Debashis Chatterjee, Chief Executive Officer and Managing Director of Mindtree, said in a statement. The company's highest-ever order book of \$570 million reflects the relevance of Mindtree's value proposition in delivering business-critical transformation at scale, Mr. Chatterjee added.

ITC will continue to deliver robust growth: Puri

Maruti Suzuki unveils mid-

sized SUV 'Grand Vitara'

'Grand Vitara' as it looks to expand presence in the fast

growing mid-sized SUV segment. The model, which comes

with a 1.5 litre petrol powertrain mated with strong and mild hybrid technology, would compete with the likes of Hyundai Creta, Kia Seltos and Tata Harrier, among others.

With the Grand Vitara, Maruti Suzuki India (MSI) is looking

to expand its presence in the mid-sized SUV segment,

where it currently lags the competition. The production

of the model would begin in August and actual sales would start in September. Speaking at the model unveil, MSI MD

and CEO Hishashi Takeuchi said the Indian automobile

industry is undergoing transformational changes in terms

of technology, customer preferences and purchasing

power. In the last few years, we have seen a growing

preference for SUVs. The segment contributes to almost

Review spectrum pricing mechanism

for captive users to incentivise

40 per cent of the total industry sales.

ministries: CAG to DoT

New Delhi: The Comp-

troller and Auditor General

(CAG) has pulled up the

telecom department for

not finalising policy on

spectrum assignment for

captive uses and flagged

the absence of spectrum

price review for captive us-

agement of spectrum as-

signed on the administra-

tive basis to government

departments, the CAG

asked the Department of

Telecom (DoT) to review

the spectrum pricing mechanism for captive

users to incentivise min-

istries, departments and

agencies, and for main-

taining spectrum man-

ferential pricing, depend-

ing on the features and

usage of various spectrum

bands, the CAG said in a

report tabled in Parlia-

ment. It noted that despite

receiving a legal opinion

(July 2021) on its own ref-

erence, regarding the method for allotment of

They may consider dif-

agement discipline.

In its report titled 'Man-

ers administratively.

New Delhi: Maruti Suzuki India unveiled its new model

Kolkata: Diversified conglomerate ITC Limited said that the company will continue to deliver robust growth despite key concerns such as inflation. The company's AGM virtually, CMD of ITC Sanjiv Puri said that in the FMCG space, the firm has nurtured 25 brands and the newer ones will garner an annual consumer spend of Rs 24,000 crore.

The company will also mega brands while investing in categories of the future, he said. It is immensely encouraging that your company's newer FMCG

Businesses have garnered an annual consumer spend of Rs 24,000 crore. The carefully selected portfolio, with substantial headroom to grow, is estimated to have a total addressable market potential of Rs 5,00,000 crore by 2030, which is amongst the highest in the Indian FMCG space, he said. ITC launched 110 products during the year, Puri said adding that the company's fudriven businesses and brands are well poised to seize the opportunities and make a

meaningful contribution to

the national priorities.

Eco on course for 8-8.5% growth based on Q1 data

ministry said that the economy is on course to achieve projected 8-8.5 per cent growth based on highfrequency indicators for the first quarter of the current fiscal. The Economic Survey tabled in the Parliament on January 31, 2022 projected the real GDP during 2022-23 to grow at 8.0-8.5 per cent. Since then, sustained growth momentum has been observed in several **High Frequency Indicators** (HFIs), indicating that the projected growth path is on course in the first quarter of FY 2022-23, minister of state for finance Pankai Chaudhary said in a written reply to Rajya Sabha. IMF, in

CHANGE OF NAME

I have changed my minor son's old name from PAKSHAL RASHESH NAHAR to new name RASHESHKUMAR NAHAR.

Add: I-201, Vachnamrut Residency, Near.Zadeshwar Chokdi, Bharuch-392011

which is being circulated for convening the AGM.

section 103 of the Companies Act, 2013.

voting/ e-voting during the AGM is provided in the Notice of the AGM.

as per the process advise by your DP.

its April 2022 update of World Economic Outlook, has also projected India's real GDP growth at 8.2 per cent in 2022-23. To ensure continued growth momentum, he said, the govern-ment has taken several steps to address high inflation imported from abroad. These include cut in excise duty on petrol and diesel and spe-

cial excise duty/cess on the export of petrol, diesel and aviation turbine fuel that are likely to alleviate inflationary pressures, he said. Further, he said, to rein in inflation, RBI in its June Monetary Policy Committee meeting hiked the repo rate by 50 basis points, on top of the earlier hike of 40 basis points in May 2022.

EXCEL INSTITUTE OF DIPLOMA STUDIES, KALOL Approved by AICTE & Affiliated with GTU (Managed by Umiya Education Trust) Address: At-Ola, Nr. Amrit Hotel, Ahmedabad-Mehsana highway, Kalol- 382721 Website: www.excelkalol.com, Email: excel_100@rediffmail.com Faculty/Staff Appointment

The state of the s			
Department	H.O.D	Lecturer	
Automobile	01	05	
Electrical	01	05	
Computer	01	10	
Mechanical	01	07	
Chemistry	00	01	
Physics	00	01	
English	00	01	
Mathemetics	00	01	

 Qualification, Experience & payscale as per AICTE & GTU norms. Interested candidates send his/her application to the director as per mention address with photograph and neccessory documents up to 06/08/2022.

UNICK FIX-A-FORM & PRINTERS LTD.

CIN: L25200GJ1993PLCO19158

PH NO. +91 9978931303/04/05, E-mail: info@unickfix-a-form.com Regd. Office: Block No.472, Tajpur Road, Changodar, Tal: Sanand, Ahmedabad-382213

Notice of 30th Annual General Meeting Remote E-voting and Book Closure

Notice is hereby given that the 30thAnnual General Meeting of the members of **Unick Fix-A-Form And Printers Limited** CIN: L25200GJ1993PLC019158 will be held on Saturday, 27th August, 2022 at 03:00 p.m. through Video Conferencing or Other Audio Video Means (OAVM) for which purpose the registered office at Block No.472, Tajpur Road, Ahmedabad - Rajkot Highway, Changodhar, Ahmedabad, Gujarat 382213 to transact the business as mentioned in the notice convening the said AGM, In view of the massive outbreak of the COVID-19 pandemic, social distancing is a norm to be followed and pursuant to the Circular No. 14/2020 dated 8th April, 2020, Circular No.17/2020 dated 13th April, 2020 issued by the Ministry of Corporate Affairs (MCA) followed by Circular No. 20/2020 dated 5th May, 2020, physical attendance of the Members to the AGM venue is not required and Annual General Meeting (AGM) be held through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM). Hence, Members can attend and participate in the ensuing AGM through VC/OAVM only and no physical presence at the meeting is required. The Notice of AGM, Annual report have been sent in electronic mode to the members whose E-mail ID's are registered with depository to members along with the Explanatory Statement and the Annual Report at their E-mail IDs respectively. A copy of the Annual Report 2021-22 is also available on the website of the Company (www.unickfix-a-form.com), and BSE website, through VC/OAVM the Process is download Zoom application (https://zoom.us/join) in Laptops / mobile/IPads then selects on join meeting and put this ID and Passcode Meeting ID: 912 1096 4194

Passcode: UNICK or Join Zoom Meeting through link https://zoom.us/j/ 91210964194?pwd=eDF1NIILQXJtbGdCT04vOVBTQXZxUT09

If you have not registered your email ID with the Company/DP, you may please follow the below instruction for obtaining login details for e-voting: Please send a request to RTA Big Share Services Pvt Ltd A/802, Samudra Physical Holding Complex, Near Klassic Gold Hotel, Girish Cold Drink, Off C.G. Road

Navrangpura, Ahemdabad- 380009 Tel No. 079-40024135 email bssahd3@bigshareonline.com, provided your name, folio no. scanned copy of share certificate(front and back) self attested scanned copy of PAN and AADHAR Card for registering email ID Demat Holding Please contact your DP and register your email address in your demat account as per the process advised by your DP

Notice is also hereby given that, pursuant to Section 91 and other applicable provisions, i any, of the Companies Act, 2013 and as per SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulation, 2015, that the **Register of Members and the Share Transfer Books of the** Company will remain closed from Saturday 20th August, 2022 to Saturday 27th August, 2022 (both days inclusive) for the purpose of 30thAnnual General Meeting (AGM). The Member who have cast their vote through remote e-voting prior to the AGM may also participate the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their vote again through e-voting facilities available during the AGM.

Once the Member cast vote on a resolution, the Membershall not be allowed to change it subsequently detailed instructions for remote e-voting joining the AGM and e-voting during the AGM is provided in the Notice of 30th AGM.

Pursuant to the provisions of Section 108of the Companies Act, 2013, read with Rules framed thereunder and as per SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide remote e-voting facility to its members to exercise their rights to vote electronically on all resolutions set forth in the Notice convening the 30th Annual General Meeting. The Notice is displayed on the Website of the Company www.unickfix-a-form.com and also on the website of BSE at https://www.bseindia.com/ stock-share-price/unick-fix-a-form-and-printers-ltd/unick/541503/

The company has engaged in the services of Central Depository Services (India) Limited (CDSL) to provide e-voting facility to its members. The company has appointed M/s. Vishakha Agrawal & Associates, Practicing Company Secretaries, Indore to act as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.

The remote e-voting facility will be available during the following voting period:-The date and time of Commencement of E-Voting-Wednesday, 24th August, 2022 at

The date and time of End of E-Voting- Friday, 26th August, 2022 at 5:00 P.M. During this period, members of the company, holding shares either in physical form or in dematerialized form as on the cutoff date (19th August 2022) may cast their vote

electronically The result of the voting will be declared within 48 hours from the conclusion of AGM i.e. on or before 29th August, 2022 and results so declared along with the Scrutnizer Report will be placed on the website of the company and BSE website

In case of you have any of queries or issues regarding e-voting write an email to helpdesk.evoting@cdsl.com call on Toll free no. 1800 22 5533 or contact our RTA Big Share Services Pvt Ltd A/802, Samudra Complex, Near Klassic Gold Hotel, Girish Cold Drink, Off C.G. Road Navrangpura, Ahemdabad- 380009 Tel No. 079-40024135 email bssahd3@bigshareonline.com

BY ORDER OF THE BOARD FOR UNICK FIX-A-FORM & PRINTERS LTD Sd/- BhupenNavnit Vasa Managing Director

DIN: 00150585

Place: Changodar

Date : 29th July, 2022

Disclaimer

Adverstisement appeared in this News Paper have not been verified factually and "WESTERNTIMES" does not responsible for the sales proposition.

departments, the department had not finalised the policy for allotment and assignment of spectrum for captive uses/other commercial services with the approval of the Digi-Communications Commission. The DCC is the apex body for telecom policy formulation. DoT had also not reviewed the pricing of spectrum assigned for captive users

spectrum for captive uses,

including government

administratively, on formulae basis since 2012, though a Committee had recommended for a periodical review of the pricing policy in 2013," the CAG report said.

stand

Instructions for registration of email Id for obtaining Annual Report and login details for e-voting: Members holding shares in physical mode are requested to register/ update the same by writing to the Company with details of folio number and attaching a self-attested copy of PAN card at Holding sawacabusiness@yahoo.com or Company's Registrar and Transfer Agent - Bigshare Services Private Limited at www.bigshareonline.com

SAWACA BUSINESS MACHINES LIMITED CIN No. L65910GJ1994PLC023926

Registered Office: 45, Chinubhai Tower, Opp. Handloom House, Ashram Road, Ahmedabad - 380009

Notice is hereby given that the Twenty Eighth (28th) Annual General Meeting ("AGM") of the Members of SAWAC/ BUSINESS MACHINES LIMITED will be held on Thursday, 25th August, 2022 at 01:00 p.m. through Video

Conferencing (VC)/Other Audio Visual Means (OAVM) to transact the business, as set out in the Notice of the AGM

In View of the continuing Covid-19 pandemic, the Ministry of Corporate Affairs (MCA) has vide its circular no. 20/2020

dated May 5, 2020 read with circular nos. 14/2020, 17/2020, 02/2021, 19/2021 and 02/2022 dated April 8, 2020, April

13, 2020, January 13, 2021, December 8, 2021 and May 05, 2022 respectively (collectively referred to as "MCA"

Circulars") and in Compliance with relevant provisions of the Companies Act, 2013 and SEBI(Listing Obligation and

Disclosure Requirements) Regulations, 2015, the AGM of the members of the Company will be held through

The Notice of the AGM along with the Annual Report 2020-21 is being sent only by electronic mode to those Members

whose email address are registered with the Company/ Depository in accordance with the aforesaid MCA Circulars and

circular no. SEBI/HO/CFD/ CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, circular no. SEBI/HO/CFD/

CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and circular no. SEBI/HO/CFD/ CMD2/CIR/P/2022/62 dated May 13

2022issued by Securities and Exchange Board of India (collectively referred to as "SEBI Circulars"). Members may

note that the Notice and Annual Report 2020-21 will also be available on the Company's website

www.sawacabusiness.com, website of the Stock Exchange i.e. Bombay Stock Exchange Limited at

www.bseindia.com and on the CDSL website at www.evotingindia.com. Members can attend and participate in the

AGM through the VC/OAVM facility only. The instruction for joining the AGM are provided in the Notice of AGM

Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum unde

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all

the resolutions which is set out in the Notice of the AGM. Members have the opinion to cast their votes on any of

the resolutions using remote e-voting facility or e-voting during the AGM. Detailed procedure for the remote e-

In case you have not registered your e-mail address with the Company/Depository. Please follow below

Please Contact your Depository Participant (DP) and register your email address In your demat account Demat

Place: Ahmedabad Date: 01.08.2022

Holding

For, SAWACA BUSINESS MACHINES LIMITED SD/- [SHETAL SHAH] DIN: 02148909, Managing Director

પાટનગર દિલ્હીમાં દારૂની

૨૦૦થી વધુ દુકાનો બંધ

દિલ્હી સરકારની નવી દારૂ

નીતિ આવ્યાને હજુ ૯ મહિના પણ

નથી થયા, આ દરમિયાન ૨૦૦થી

વધુ દુકાનો બંધ પણ થઇ ગઇ છે,

આગામી દિવસોમાં વધુ દુકાનો પણ બંધ થઇ શકે છે. દિલ્હીમાં દારૂનો

કારોબાર કરતા કારોબારીઓ

સરકારની દારૂ નીતિને અવગણી

રહ્યા છે અને દુંકાનો બંધ કરવાની

શરૂ કરી દીધી છે. આની પાછળનું

મોટું કારણ દુકાનદારોને થઇ રહેલું

આર્થિક નુકસાન છે. આ કારણે તેઓ

પોતાના લાયસન્સ સરકારને પાછા

એક ફરી વાર દારૂને લઇને હાહાકાર

મચી શકે છે. સૂત્રો અનુસાર,

અત્યાર સુધી દિલ્હીમાં ૯ ઝોન

પોતાના લાયસન્સ એક્સાઇઝ

ડિપાર્ટમેન્ટને સરેન્ડર કરી ચૂક્યા છે.

એટલે કે, લગભગ ૧૬૦થી વધુ

આવનારા દિવસોમાં દિલ્હીમાં

આપી રહ્યા છે.

સંજય અરોડા હવે દિલ્હીના નવા પોલીસ કમિશનર હશે

સંજય અરોડા હવે દિલ્હીના નવા પોલીસ કમિશનર હશે. સંજય અરોડા વર્ષ ૧૯૮૮ બેચના આઈપીએસ અધિકારી છે. આ સંબંધમાં રવિવારે ગૃહ મંત્રાલય તરફથી એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સંજય અરોડા પહેલા ITBઁ ના ચીફ હતા. તેઓ રાકેશ અસ્થાનાની જગ્યા લેશે. તમને જણાવી દઈએ કે રાકેશ અસ્થાના પાછલા વર્ષે જુલાઈ મહિનામાં દિલ્હી પોલીસના મુખિયા બન્યા હતા. રવિવાર એટલે કે ૩૧ જુલાઈએ રાકેશ અસ્થાના પોતાના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે.

ગૃહ મંત્રાલય તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે સંજય અરોડા ૧ ઓગસ્ટના રાકેશ અસ્થાનાની જગ્યા લેશે. સંજય

અક્ષય કુમાર સ્ટાર 'રામ સેતુ'

કાનૂની વિવાદોમાં ઘેરાય ગઈ છે.

તાજેતરમાં બીજેપી નેતા સુબ્રમણ્યમ

સ્વામીએ તેના નિર્મતાઓ પર

ફિલ્મમાં રામસેતુ અંગે ખોટાં તથ્યો

બતાવવામાં આવ્યા છે. સ્વામીએ

પોતાની ટ્વિટમાં કહ્યું કે, તેઓ

ફિલ્મના નિર્માતાઓ પાસેથી

વળતરની પણ માગ કરશે. ફિલ્મમાં

અક્ષય સિવાય જેકલિન ફર્નાન્ડિઝ

અને નુસરત ભરુચા પણ છે.

ફિલ્મનું શૂટિંગ અયોધ્યા અને રામેશ્વર સહિત ઘણા લોકેશન પર

થયું છે. ફિલ્મને અભિષેક શર્માએ

ડાયરેક્ટ કરી છે. ફિલ્મ પોતાના

નામના કારણે શરૂઆતથી ચર્ચામાં

છે. સુબ્રમણ્યમ સ્વામીએ એક

ટ્વિટમાં લખ્યું, અક્ષય કુમાર વિદેશી

નાગરિક છે અને તેઓ તેને દેશમાંથી

બહાર જવાનું પણ કહી શકે છે.

(એજન્સી) ચંદીગઢ,

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા

મંત્રી અમિત શાહે આજે ચંદીગઢમાં

નશીલાં દ્રવ્યોની તસ્કરી અને રાષ્ટ્રીય

સુરક્ષા પર રાષ્ટ્રીય સંમેલનને

સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં

હરિયાણા, હિમાચલ પ્રદેશ અને

પંજાબના મુખ્યમંત્રીઓ, ચંદીગઢના

એનઆઈએ અને એનસીબીના

અધિકારીઓ તેમજ રાજ્યોના

એએનટીએફના વડા અને એક્રોર્ડના

સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો

બીજી તરફ નાર્કોટિક્સ કંટ્રોલ

બ્યૂરોએ દેશના ચાર શહેરોમાં

પકડાયેલા લગભગ ૩૧,૦૦૦ કિલોગ્રામ ડ્રગ્સને સળગાવી નષ્ટ

કરી દીધું હતુંં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ

જણાવ્યું હતું કે, ડ્રગ્સની દાણચોરી

અને પ્રસાર કોઇ પણ સમાજ માટે

ખૂબ જ ઘાતક હોય છે. નશીલા

પદાર્થોની તસ્કરી બાદ જ્યારે તે

સમાજમાં ફેલાય છે ત્યારે પેઢીઓને

ખોખલી બનાવી દે છે અને દેશ અને

સમાજનાં મૂળિયા ખોખલા કરવા ઉધઈની જેમેં કામ કરે છે. નશીલા

દ્રવ્યોની દાણચોરી સામે શૂન્ય

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા

જેઓએ પોતાનું જીવન આર્થિક

ઉપાર્જનની આશા વગર માનવ સેવા

કે સમાજ સેવામાં જોતરી દીધું હોય

तेवा ११ धरतीरलोने धरती रल

પુરસ્કાર દ્વારા નવાજવાનાં કાર્યક્રમનું

આયોજન કરવામાં આવ્યું હતું. આ

એવોર્ડ સમારંભ રાજ્યના મુખ્યમંત્રી

ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં

ર્યોજાયો હતો. આ પ્રસંગે ધરતી રત્ન

એવોર્ડ-૮ના અતિથિ વિશેષ તરીકે

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ

અમીન, મુખ્ય સ્પોન્સર પી. એસ.

પટેલ, આશીર્વાદ ફાઉન્ડેશનના

સંસ્થાપક સીએ આર. એસ. પટેલ,

સહિત ટ્રસ્ટના અગ્રણી હોદ્દેદારો

કરવાના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી

ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે

સમાજ સેવા કે માનવ સેવા કરનારા

ધરતી રત્નો સમાજના એવા પુષ્પો છે

કે જેઓ તેમના સેવાકીય કાર્ય દ્વારા

સમાજને સતત મધમધતો બાગ

આશીર્વાદ ફાઉન્ડેશનના

સંસ્થાપક સીએ આર એસ પટેલે

તેમના પ્રાસંગિક ઉદબોધનમાં

ધરતી રહ્ની એવોર્ડ એનાયત

ઉપસ્થિત રહ્યા હતા.

આશીર્વાદ ફાઉન્ડેશન હારા ૧૧ ધરતી રલોને પુરસ્કૃત કરાયા

અમદાવાદ, વિશાળ છે, જેની સામે ન્ડેશન દ્વારા માનુવસેવકોની સંખ્યા ખૂબ જ્

સીમિત છે. પરંતુ જે લોકો નિસ્વાર્થભાવે કોઈપણ આર્થિક

કમિશનર હશે. ગૃહ મંત્રાલય તરફથી આદેશ જારી થવાના કેટલાક સમય પહેલા પૂર્વ દિલ્હીના ઓફિસર રાકેશ અસ્થાનાની ફેરવેલની તૈયારીમાં લાગી ગયા હતા. સાંજે ૪ કલાકે કિંગ્સવે કેમ્પ પોલીસ લાઇનમાં તેમની ફેરવેલ

સંજય અરોડાએ ૨૦૦૨થી ૨૦૦૪ સુધી કોયંબટૂર સિટીના પોલીસ કમિશનરના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસ ડેપ્યુટી મહાનિરીક્ષક, વિલ્લુપુરમ રેન્જના રૂપમાં જવાબદારી સંભાળી હતી.

સંજય અરોડાએ આઈપી (સ્પેશિયલ ઓપરેશન્સ) બીએસએફ, આઈજી છત્તીસગઢ સેક્ટર સીઆરપીએફ અને આઈજી

અક્ષય કુમારની રામસેતુ કાનૂની વિવાદોમાં ફસાઈ

છે. હું અક્ષય કુમાર તથા કર્મા મીડિયા વિરુદ્ધ કેસ કરવાનો છું,

કારણ કે તેણે પોતાની અપકમિંગ

ફિલ્મ 'રામસેતુ'માં તથ્યોને ખોટી

રીતે બતાવ્યા છે. આ ફિલ્મથી

રામસેતુની ઇમેજને નુકસાન થઈ

'રામસેતુ'નું થોડાં સમય પહેલાં એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું

હતું. આ પોસ્ટર જોઈને સો.મીડિયા

યુઝર્સે એક્ટરને ઘણો જ ટ્રોલ કર્યો

હતો. આ પોસ્ટરમાં અક્ષય કુમાર

ગુફામાં એક હાથમાં મશાલ લઈને

ઊભો છે. તેની બાજુમાં જેકલિન

ટોર્ચ સાથે છે. યુઝર્સને ટોર્ચ તથા

મશાલનું લૉજિક સમજમાં આવ્યું

નહીં અને તેથી ટ્રોલ કરવામાં આવ્યો

હતો. 'રામ સેતુ'માં અક્ષય કુમાર

આર્કિયોલૉજિસ્ટના રોલમાં છે. તે

અમિત શાહે ડ્રગ્સની દાણચોરીને

સમાજ માટે ખૂબ ઘાતક ગણાવી

કોઈ પણ તંદુરસ્ત, સમૃદ્ધ, સક્ષમ

અને સલામત રાષ્ટ્ર તેનો હેતુ સિદ્ધ

કરી શકે નહીં. તેમણે કહ્યું કે, ડ્રગ્સ સામેની લડાઈ સામાજિક રીતે પણ

ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમજ તેમને કહ્યું કે, મારો વકીલ ભારત તથા શ્રીલંકા વચ્ચે બનેલા સત્ય સભ્રવાલ આ કેસ જોઈ રહ્યો રામસેતુની સત્યતા ચકાસવાનું કામ્

(એજન્સી) નવી દિલ્હી, અરોડા દિલ્હી પોલીસના ૨૫મા ઓપરેશન્સ સીઆરપીએકના રૂપમાં કામ કર્યુ છે. ઘણા મહત્વના પુરસ્કારોથી સન્માનિત સંજય અરોડા જ્યારે તમિલનાડુમાં ટાસ્ટ ફોર્સના પોલીસ અધીક્ષકના પદ પર તૈનાત હતા ત્યારે તેમણે કુખ્યાત ચંદન તસ્કર વીરપ્પન ગેંગ વિરુદ્ધ મહત્વની કાર્યવાહી કરી હતી. વીરપ્પન વિરુદ્ધ વીરતા દેખાડવા માટે તેમનું મુખ્યમંત્રી વીરતા મેડલથી સન્માન કરવામાં આવ્યું

> ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાપતની ડિગ્રી મેળનાર અરોડા वर्ष २००२-२००४ वश्ये કોયંબટૂરના પોલીસ કમિશનર પણ રહી ચુકેચા છે. સંજય અરોડાએ સીઆરપીએફ અને બીએસએફમાં પોતાની સેવા આપી છે.

> કરે છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ ઉપરાંત ઉત્તરપ્રદેશ સહિત વિવિધ

લોકેશન પર કરવામાં આવ્યું છે.

અભિષેક શર્માના નિર્દેશનમાં બનેલી

આ ફિલ્મ આ વર્ષે ૨૪ ઓક્ટોબરે

સિનેમાઘરોમાં રિલીઝ થશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય

કુમાર અત્યારે પોતાની આગામી

ફિલ્મ 'રક્ષાબંધન'ના પ્રમોશનમાં

વ્યસ્ત છે. આ ફિલ્મમાં ભૂમિ

પેડનેકર, સહજમીન કૌર, દીપિકા

ખજ્ઞા, સાદિયા ખતીબ, સ્મૃતિ

શ્રીકાંત અને સીમા પાહવા મુખ્ય

ભૂમિકામાં છે. રક્ષાબંધન ૧૧

ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ

થશે. આ દિવસે બોક્સ ઓફિસ પર

આમિર ખાન અને કરિના કપૂર

ખાનની 'લાલ સિંહ ચડ્ઢા' પણ

પ્રવૃત્તિઓમાં થાય છે. એક તરફ

નશીલા પદાર્થોની તસ્કરી અને તેના

પ્રસારને અટકાવીને આપણે

આવનારી પેઢીઓને બરબાદીથી

બચાવવા માગીએ છીએ, સાથે જ

દુકાનો બંધ થઇ ચૂકી છે. પૂર્વ દિલ્હીમાં દારૂની નવી નીતિ હેઠળ એક કારોબારીએ કહ્યું કે, સરકાર પોતાની પોલીસીને પોતે જ ખરી રીતે ઇમ્પ્લીમેન્ટ નથી કરી શકી અને નથી સમજી શકી. ખરેખર,

(એજન્સી) નવીદિલ્હી, આપવાની છૂટ આપી હતી. પછી સરકારે તેને હટાવી લીધી. પછી ફરીથી દારૂ પર ડિસ્કાઉન્ટ આપવાની છૂટ આપી. તેનાથી કારોબારીઓને નુકસાન થયું. આની સાથે નવી પોલીસી બાદ દારૂની અમૂક બ્રાન્ડ બંધ થઇ ગઇ, જેનાથી દારૂના શોખીનોએ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. ઘણા લોકોએ પસંદ કરેલી બ્રાન્ડ ન મળતા તેને ખરીદવાની છોડી દીધી. તેનાથી પણ દારૂ કંપનીઓએ નુકસાન ઉઠાવવું

> સાઉથ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં દારૂના મોટા વેન્ડરે પમી મેના રોજ એક ઝોન સરકારને સરેન્ડર કરી દીધુ હતું. સરકારની નવી પોલીસી હેઠળ દરેક વોર્ડમાં દારૂની દુકાનો ખોલવામાં આવે, જેનાથી સ્પર્ધો વધી ગઇ. દારૂના કારોબારીઓએ લોકોને મોટા ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું. પણ બાદમાં સરકાર દ્વારા ડિસ્કાઉન્ટ હટાવવામાં આવ્યું. તેનાથી દારૂના કારોબારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું. તે સિવાય નવી પોલીસી હેઠળ બોર્ડર એરિયા પર દારૂ કારોબારી દુકાનો ન ખોલી શક્યાં. તેથી તેમને ઘણું

વ્યાજ દરોમાં ૫૦ બેસિસ પોઇન્ટની વુદ્ધિની સંભાવના, લોન મોંઘી થશે

(એજન્સી) મુંબઇ,

વિભિન્ન કંડ મેનેજરો અને અર્થશાસ્ત્રીઓના અનુમાન અનુસાર, ભારતીય રિઝર્વ બેક્રની રેટ સેટિંગ કમીટી ૩-૫ ઓગસ્ટ દરમિયાન થનારી મોનેટરી પોલીસીની મીટિંગમાં રેપો રેટમાં ૨૫થી ૫૦ બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે. નીતિગત મુદ્દે અર્થશાસ્ત્રીઓ અને કંડ મેનેજરોની મીશ્રીત સલાહ છે. કેટલાક લોકો આશા કરી રહ્યા છે કે, રેટ તટસ્થ રહેશે, જ્યારે કેટલાકનું કહેવું છે કે, રેટ હાઇક ચાલુ રહી શકે છે. રીટેલ મોંઘવારી RBI™k લક્ષ્યની ઉપર બનેલી છે. એવામાં રેપો રેટમાં વધારાની પૂર્ણ આશંકા છે. જો, એક વખત ફરીથી રેપો રેટમાં વધારો થાય છે તો દરેક પ્રકારની લોન મોંઘી થઇ જશે. એટલે કે, કાર

ઇન્ફ્લેશનના મોર્ચે, એક અન્ય

પાસ-થ્રુ અને નબળા મોનસૂનના કારણે ખાદ્ય કિંમતોમાં વધારો થવાથી ઘરેલુ ઇન્ફ્લેશન માટે જોખમ વધી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, જીઓ-પોલીટીકલ તણાવ અને ઉર્જાની કિંમતોનો પ્રભાવ ઇન્ફ્લેશન માટે જોખમી બની રહેશે. ઇન્ફ્લેશનની સાથે સાથે RBI બહારી ક્ષેત્રના અસંતુલન પ્રતિ પણ સચેત રહેશે.

બિહારના ઘણા જિલ્લામાં ભુકંપના આંચકા

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ની હતીઃ

રોજ નેપાળની રાજધાની કાઠમાંડૂ

અને પોખારા શહેરની વચ્ચે ૭.૮ની

તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ

ભૂકંપે નેપાળમાં વિનાશ વેર્યો હતો.

આ ભૂકંપના કારણે નેપાળમાં

૮,૯૬૪ લોકોના મોત થયા હતા

અને લગભગ ૨૨ હજાર લોકો

ઘાયલ થયો હતો. નેપાળમાં આવેલા

આ વિનાશકારી ભૂકંપને ગોરખા

ભૂકંપના નામથી પણ ઓળખવામાં

આવે છે. આ ભૂકંપે ઉત્તર ભારતના

ઘણા શહેરો સહિત પાકિસ્તાન અને

બાંગ્લાદેશના અમુક વિસ્તારોને

હલાવી દીધા હતા. ભૂકંપના કારણે

કાઠમાંડૂનું એરપોર્ટ બંધે કરવું પડ્યું

હતું. ભૂકંપના કારણે માઉન્ટ

(એજન્સી)કાઠમંડુ, નેપાળમાં ફરી એકવાર તેજ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પ.પની માપવામાં આવી હતી. આજે સવારે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપ કાઠમંડુથી ૧૪૭ કિમી દૂરે આવ્યો હતો. નેપાળના સમયે અનુસાર સવારે ૮:૧૩ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, ખોટાંગ જિલ્લામાં મારતિમ બિરતા નામના સ્થળે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૂર્વ નેપાળના ૧૦ કિમીની ત્રિજ્યામાં નોંધવામાં આવ્યું

નેપાળમાં આવેલા આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા છે. હાલમાં નોંધાયેલા ભૂકંપોથી નેપાળમાં મોટી સંખ્યામાં

ભૂકંપ કાઠમંડુથી ૧૪७ કિમી દૂર આવ્યો હતો જાનહાનિ અને માનહાનિ જોવા એવરેસ્ટ પર બરફનું તોફાન આવ્યું

મળી હતી. ૨૫ એપ્રિલ ૨૦૧૫ના હતું, જેમાં ૨૨ લોકોના મોત થયા

૧૨ મે ૨૦૧૫માં પણ એક ભાકંપે વિનાશ વેર્યો હતો. તેનું એપીસેન્ટર ચીની સીમાની પાર્સે કાઠમાંડૂ અને માઉન્ટ એવરેસ્ટની વચ્ચે હતું. આ ભૂકંપના કારણે ૨૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો અને ર ૫૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ૧૯૩૪માં નેપાળમાં અત્યાર સુધીનો સૌથી ભયંકર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૮.૦ નોધવામાં આવી હતી. તેની રાજધાની કાઠમાંડૂ સહિત નેપાળના ભક્તપુર અને પોટનમાં તબાહી

દેશમાં કોરોનાના નવા ૧૯૬७૩ કેસ

(એજન્સી) નવી દિલ્હી, ભારતમાં. સ્વાસ્થ્ય મંત્રાલયના

જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૬૭૩ નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ ઘટીને ૧.૪૩ લાખ થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને ૧,૪૩,૬૪૬ થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૬,૩૫૭ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૪,૩૩,૪૯,૭૭૮ લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ ૨૦૪,૨૫,૬૯,૫૦૯ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૩૧,૩૬,૦૨૯ ડોઝ ગઈકાલે અપાયા હતા.

જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા તે આ મુજબ છે. ૩૦ જુલાઈ ૨૦,૪૦૮ નવા કેસ નોંધાયા અને ૫૪ સંક્રમિતોએ જીવ

ગુમાવ્યા. ૨૯ જુલાઈએ ૨૦,૪૦૯ નવા કેસ નોંધાયા. ૨૮ જુલાઈએ ૨૦,૫૫૭ કોરોના કેસ નોંધાયા અને ૪૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૨૭ જુલાઈએ ૧૪,૮૩૦ નવા કેસ નોંધાયા અને પ૭ લોકોના મોત થયા હતા. ૨૬ જુલાઈએ ૧૪,૮૩૦ નવા કેસ નોંધાયા હતા અને ૩૬ લોકોને કોરોના ભરખી ગયો હતો. ૨૫ જુલાઈએ ૧૬,૮૬૬ નુવા કેસ નોંધાયા છે અને ૪૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૨૪ જુલાઈએ ૨૦,૨૭૯ નવા કેસ નોંધાયા હતા અને ૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો. ૨૩ **જૂલાઈએ ૨૧,૪૧૧ નવા કેસ** નોંધાયા અને ૬૭ લોકોના મોત થયા. ૨૨ જુલાઈએ ૨૧,૮૮૦ નવા કેસ નોંધાયા અને ૬૦ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો. ૨૧

જુલાઈએ ૨૧,૫૬૬ કેસ નોંધાયા હતા. ૨૦ જુલાઈએ ૨૦,૪૪૭ નવા કેસ નોંધાયા હતા. ૧૯ જૂલાઈએ ૧૫,૫૨૮ નવા કેસ ર્નોંધાયા અને ૨૫ સંક્રમિતોના મોત થયાહતા. ૧૮ જુલાઈએ ૧૬,૯૩૫ નવા કેસ નોંધાયા અને પ૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા. ૧૭ જુલાઈએ ૨૦,૦૪૪ નવા કેસ નોંધાયા અને ૪૯ સંક્રમિતોના મોત થયા. ૧૬ જુલાઈએ ૨૦,પ૧૪ નવા કેસ નોંધાયા અને પદ સંક્રમિતોના મોત થયા હતા. ૧૫ જુલાઈએ ૨૦,૦૩૮ નવા કોવિડ કેસ અને ૪૭ સંક્રમિતોના મોત થયા. ૧૪ જુલાઈએ ૨૦,૧૩૯ નવા કોવિડ કેસ અને ૩૮ સંક્રમિતોના મોત થયા. ૧૩ જુલાઈએ ૧૬,૯૦૬ નવા કેસ અને ૪૫ સંક્રમિતોના મોત થયા હતા.

પહેલા સરકારે દારૂ પર ડિસ્કાઉન્ટ

લોન સહિત બીજી અન્ય લોનના EMI

એક અર્થશાસ્ત્રીએ કહ્યું કે, આપણે ઓગસ્ટ નીતિ સમીક્ષામાં રેપો રેટમાં ૪૦-૫૦ બેસિસ પોઇન્ટના વધારાની આશા રાખવી જોઇએ. પાછલી બે નીતિઓમાં, કેન્દ્રીય બેક્રે ઉચ્ચ ઇન્ફ્લેશનના કારણે મે અને જૂનમાં ૯૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. રેપો રેટમાં વધારો ૨૫-૩૫ બેસિસ પોઇન્ટ્સ તટસ્થ રહી શકે છે. કોમોડિટીની કિમતોમાં સુધારા અને કાચા તેલની કિંમતોમાં સુધારાને જોતા માર્ગદર્શન પાછલી નીતિની તુલનામાં આરામદાયક રહી શકે છે.

અર્થશાસ્ત્રીએ કહ્યું કે, ઉંચી ઇનપુટ કિંમતોની નિરંતર પાસ-શ્રુ, ઘરેલુ પંપની કિંમતોમાં ઉંચા કાચા તેલની કિંમતોના

(એજન્સી) નવીદિલ્હી, ભારતની ગુપ્તચર એજન્સી રો

(રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) મોરીશસમાં જઈને લોકોના ઈન્ટરનેટ અકાઉન્ટની જાસૂસીને લઈને વિવાદોમાં ઘેરાઈ ગઈે છે. પરંતુ, શું તમે જાણો છો કે ભારતમાં જ લોકોના ઈન્ટરનેટનું મોનિટરિંગ સરકારી એજન્સીઓ કરી રહી છે? કદાચ તમે તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે અમેરિકાની ગુપ્તચર એજન્સી પણ તમારા ઈ-મેલ અથવા વોટ્સએપ ચેટ પર નજર રાખે છે?

૨૦૧૩માં એનએસએના પૂર્વ કર્મચારી એડવર્ડ સ્નોડનના લીક દસ્તાવેજોમાં આ વાત સામે આવી હતી કે અમેરિકા સમગ્ર દુનિયામાં ફાઈબર ઓપ્ટિક ટેપ દ્વારા લોકોના ઈન્ટરનેટ ટ્રાફિક પર નજર રાખે છે. ખાસ વાત એ છે કે, આ દસ્તાવેજોના લીક થયેલા એક મેપ અનુસાર, અમેરિકાની ગુપ્તચર એજન્સી ચીન

ચીન કરતા વધુ ભારતની જાસુસી કરતા પણ વધુ ડેટા ભારત અને તેમા મોરીશસ ટેલીકોમ કંપનીના પાકિસ્તાનમાંથી ભેગા કરે છે. તે ઝઈં અને વડાપ્રધાન પ્રવીદ જગુનાથના નજીકના મનાતા શેરી સમયે એવુ સામે આવ્યું હતું કે,

અમેરિકાના જાસૂસીના લિસ્ટમાં ભારત પાંચમાં નંબર પર છે. ભારતમાંથી ૬૩ કરોડ ઈન્ટેલિજન્સ સૂચનાઓ અમેરિકાએ લીધી હતી. પરંતુ, ત્યારથી આજસુધી કોઈપણ સરકાર અથવા વિપક્ષી દળે આ વાતને મુદ્દો નથી બનાવ્યો. કારણ, સરકાર પોતે પણ તમારા ડેટા પર નજર રાખે છે.

૨૦૧૫માં ચીની ટેલિકોમ કંપની Huaweેને મોરીશસની ટેલી-કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સ બેઝ રાજધાનીમાં સર્વેલન્સ સિસ્ટમ બનાવી શકે છે. સૌથી મોટું જોખમ

Physical Holding

Demat Holding

Place : Changodar

Date : 29th July, 2022

સિંહની ભૂમિકા મહત્ત્વની માનવામાં આવી રહીં હતી. આ પ્રોજેક્ટ પર કામ દરમિયાન જ Huaweેને મોરીશસના બીજા સૌથી મોટા શહેર રોડરીગઝ સુધી હાઈ સ્પીડ ઈન્ટરનેટ પહોંચાડવા માટે ૭૦૦ કિલોમીટર અંડર-સી ઈન્ટરનેટ કેબલ પાથરવાનો કોન્ટ્રાક્ટ પણ મળી ગયો. એ આશંકા વ્યક્ત કરાવા માંડી કે આ બહાને ચીન મોરીશસમાં પોતાનું ઈન્સ્ટોલ કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. આગાલેગા દ્વિપ પર ભારતના

UNICK FIX-A-FORM & PRINTERS LTD.

CIN: L25200GJ1993PLCO19158

PH NO. +91 9978931303/04/05, E-mail: info@unickfix-a-form.com

Regd. Office: Block No.472, Tajpur Road, Changodar, Tal: Sanand, Ahmedabad-382213

Notice of 30th Annual General Meeting,

Remote E-voting and Book Closure

Notice is hereby given that the 30thAnnual General Meeting of the members of Unick Fix-A-Form And Printers Limited CIN: L25200GJ1993PLC019158 will be held on Saturday, 27th August, 2022 at 03:00 p.m. through Video Conferencing or Other Audio Video Means (OAVM) for which purpose the registered office at Block No.472, Tajpur Road, Ahmedabad - Rajkot Highway, Changodhar, Ahmedabad, Gujarat 382213 to transact the business as mentioned in the notice convening the said AGM, In view of the massive outbreak of the COVID-19

pandemic, social distancing is a norm to be followed and pursuant to the Circular No. 14/2020 dated 8th April, 2020, Circular No.17/2020 dated 13th April, 2020 issued by the Ministry of Corporate Affairs (MCA) followed by Circular No. 20/2020 dated 5th May, 2020, physical

attendance of the Members to the AGM venue is not required and Annual General Meeting (AGM) be held through Video Conferencing (VC) or OtherAudio Visual Means (OAVM). Hence, Members can attend and participate in the ensuing AGM through VC/OAVM only and no physical presence at the meeting is required. The Notice of AGM, Annual report have been sent in

electronic mode to the members whose E-mail ID's are registered with depository to members

along with the Explanatory Statement and the Annual Report at their E-mail IDs respectively. A copy of the Annual Report 2021-22 is also available on the website of the Company

(www.unickfix-a-form.com), and BSE website, through VC/OAVM the Process is download Zoom application (https://zoom.us/join) in Laptops / mobile/IPads then selects on join meeting and put this ID and Passcode Meeting ID: 912 1096 4194

Passcode: UNICK or Join Zoom Meeting through link https://zoom.us/j/91210964194?pwd=eDF1NIILQXJtbGdCT04vOVBTQXZxUT09

If you have not registered your email ID with the Company/DP, you may please follow the below instruction for obtaining login details for e-voting:

Please send a request to RTA Big Share Services Pvt Ltd A/802, Samudra

Complex, Near Klassic Gold Hotel, Girish Cold Drink, Off C.G. Road Navrangpura, Ahemdabad- 380009 Tel No. 079-40024135 email

bssahd3@bigshareonline.com, provided your name, folio no. scanned

copy of share certificate(front and back) self attested scanned copy of

Please contact your DP and register your email address in your demat

બનાવેલા મેરીટાઈમ ઈન્ટેલિજન્સ બેઝને હતું. ગત મહિને મોરીશસ ટેલીકોમનાં CEO શેરી સિંહે એવ કહીને રાજીનામુ આપી દીધુ હતું કે, વડાપ્રધાને તેમને આદેશ આપ્યો હતો કે ભારતીય ગુપ્તચર એજન્સીને બેઈ-ડચુ-જાકાટેઁદ્વીપ પર બનેલા સબમરીન કેબલ સ્ટેશનનું એક્સેસ આપી દે. તેને વિરોધી પાર્ટીઓએ દેશની સંપ્રભુતા પર જોખમ ગણાવીને વડાપ્રધાનના રાજીનામા ની પણ માગણી કરી હતી. વડાપ્રધાન પ્રવીંદ જગુનાથ જાહેરમાં કહી ચુક્ચા છે કે, ચીનના ઈરાદા પર શંકૉના કારણે તેમણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી હતી.

તે દેશની અર્થવ્યવસ્થાને નશાના વેપારથી પેદા થતા ગંદા ખોખલી બનાવવાનો પ્રયાસ કરી નાણાંનો ઉપયોગ દેશની વિરુદ્ધ વહીવટકર્તા, બીએસએફ, રહ્યા છે, દેશની સુરક્ષાની દ્રષ્ટિએ કરવામાં આવે છે, તેને રોકવાનું પણ આપણા દેશની સુરક્ષા માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ

સહિષ્ણુતાની નીતિ અપનાવ્યા વિના નાણાં નો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી

ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા જ્યોતિ હાઈસ્કૂલમા ઇનામ વિતરણ

કે ડ્રગ્સના વેપારથી ઉત્પન્ન થતા ગંદા મહત્વપૂર્ણ છે.

(પ્રતિનિધી)ખેડબ્રહ્મા ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા ભારત કો જાનો પ્રકલ્પ અંતર્ગત ભારત કો જાનો પ્રશ્નમંચ ૨૦૨૧ માં ધોરણ છ થી આઠ અને ધોરણ ૯ થી ૧૨ માં શાખા કક્ષાએ અને પ્રાન્ત કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં શાખા કક્ષાએ અને પ્રાન્ત કક્ષાએ પ્રથમ આવનાર ઋત્વી ચૌહાણ, શાખા કક્ષાએ ખુશી સુથાર અને તૃતીય આવનાર ભવ્ય પરમાર હાઈસ્કૂલનુ સન્માન શાળાના આંચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે કર્યું હતું. જ્યારે કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્મા ના વિદ્યાર્થી પૃથ્વી પટેલ અને સુરેશકુમાર અરવિંદેભાઈ હોથાનું સન્માન આચાર્યશ્રી વિભાષ કુમાર રાવલે કર્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના મહિલા સંયોજિકા સ્મિતાબેન

જોશી, શાળાના શિક્ષક શ્રીઓ અને ગ્રંથપાલ રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા

હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભારત કો જાનો પ્રકલ્પના સંયોજક ડો હરપાલસિંહ ચૌહાણ, શક્તિસિંહ સોલંકી અને મિલનભાઈ પટેલે કર્યું હતું.

ડીમાન્ડ નોટીસ

SIAIOS ઝાદાસ (ક્રિક્યોરિટાઇઝેશન એન્ડ રિકસ્ટ્રકશન ઓફ ફાઇનાસિયલ એસેટ્સ એન્ડ એન્ડ્રને મેન્ટ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ (આ કાયદો) સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્કોસંમેન્ટ) રૂલ્લ, ૨૦૦૨ ના નિયમ (આ નિયમો) ૩(૧) સાથે વાંચવામાં આવ્યો છે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલ સત્તાઓના ઉપયોગમાં આ નિયમોના નિયમ ૩ ની સાથે વાંચતા, આઈઆઈએકએલ ગુલ કાઇનાન્ય લિયિક (IFL HFL) (અગાઉ ઈન્ડિયા ઇન્કોલાઇન લાઉસેંગ કાઇનાન્ય લિયિક)ના અધિકૃત અધિકારીએ જારી કર્યા છે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩ (૨) હેઠળ માંગણી નોટિસ, ઉપાર લેગારા (ઓ) ને, તેઓને સંબંધિત ડિમાન્ડ નોટિસ (ઓ)માં જુણાવેલ ટકમ પરત કરવા માટે હાકલ કરે છે. ઉપરત્ય સંબંધમાં, કરીથી આ સુરત્યા પ્રકાશિત થયાની તારીખથી ૬૦ રિસ્સ એંદ લેશકાર હતા, મીને જુણાવેલ કરમ, ઓ માંગણી સુરત્યા વૃક્કણીની તારીખ સુધી લેક્ષદાર (ઓ) ની વિગત, તારીખ મુજબની ૨કમ માંગની સુચના અને લોનની ૨કમની ચુકવણી માટે આપવામાં આવતી સુરક્ષા નીચે મુજબ છે: ડીમાન્ડ નોટીસ તારીખ અને ૨૬મ સિક્યોર્ડ એસેટ (સ્થાઇ મિલ્કત)નું વર્ણન

જામીઝદારોના નામો શ્રી. ઉદયબીર રામભરોસે શ્રીવાસ, શ્રીમતી શારદાબેન શ્રીવાસ (Prospect No. 809827& 918783)	26-July થ Prospect no.809827 Rs.12,80,882/- (રૂપિયા બાર લાખ એસી હજાર આઠસો બ્યાંસો કંકત) Prospect no.918783 Rs.2,73,324/- (રૂપિયા બે લાખ તોત્તેર હજાર ત્રણસો ચોવીસ કંક્ત)	એક પ૦૨ તારા સાર્ય માપ કર કે.ક્ટ્રેટ, વૃંદાવન સ્કાયલાઇન, નીલર્ક્ડ શ્રીની પાછળ, મહેસુલ ભવન સામે, એસ.પી.રીંગ રોડ, વસાલ, અમદાવાદ, ૩૮૨૪૧૮, ગુજરાત ભારત ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત			
શ્રી પુનિતકુમાર વાલંદ, શ્રીમતી.હિરાબેન વાલંદ (Prospect No. 913216)	28-July-2022 Rs.12,39,675/- (રૂપિયા બાર લાખ ઓગણ ચાલીસ હજાર છસો પંચોત્તેર ફક્ત)	ફલેટ નં.ઈ-૨૦૪, બીજો માળ, બ્લોક-ઈ, આશરે માપ ૩૦.૪ ર સ્ક્રે.મીટર (કારપટ એરીયા), અભિલાયો સ્ક્રીડેન્સી, રિઝ-૧ અને ૨), સિદ્ધો એલીગન્ટ નજીક અને ન્યુ ભગીરથ સેરીનીટી લેગેલાં, લાંભા રોડ, લાંભા, અમદાવાદ, ગુજરાત-૩૮૨૪૦૫, ભારત ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત			
શ્રી, સુંજાત કુશવાહ, શ્રીમતી. મંદારી સુંજીતભાઈ કુશવાહા, શ્રી ક્રિષ્ના ડેરી પાહેર (Prospect No. IL10074911)	28-July-2022 Rs.12,37,734/- (રૂપિયા બાર લાખ સડત્રીસ હજાર સાતસો ચોત્રીસ કકત)	એ-૩૦૬, ત્રીજો માળ, આશરે માપ ૩૬, ૨૪ સ્કે. મીટર (કારપેટ એરીયા), વાંશ એરીયાનું માપ ૨.૭૦ સ્કે. મીટર (કુલ એરીયાનું માપ ૩૮.૪ સ્કે. મીટર)એ એલિયાજિત જમીન વિસ્તાર ૩૪.૧૩ સ્કે. મીટર, સહજાનંદ એવન્યુ, સિગ્નેચર પ્રાઈડની પાસે, સોનાથ સોસાયટીની પાછળ, રામદેવ પીર મંદિરની સામે, સિંગરવા ગામ, તાલુકો-દર્સકોઈ, અમદાવાદ, ગુજરાત- ૩૮૨૪૩૦ભારત ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત			
III . staved avenue & u.c. fa	a) and discontinuous the HELD are and commit Days on a HELD HELD and a Day Days (a) day (a) day				

જો આ દેવાદાર ઉપરોક્ત IIFL, HFLને ચૂકવણી કરવામાં નિષ્ઠળ જાય તો IIFL, HFL આ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ ઉપરોક્ત સિક્યોર્ડ એસેટ્સ સામે કાર્યવાહી હાથ ધરશે અને લાગુ થતા નિયમો/સમગ્રપણે તે દેવાદારના જોખમે અને ભોગે રહેશે. વધુ માહિતી માટે અધિકૃત અધિકારીશ્રીનીઃ **લાંચ ઓકીસ**ઃ IIFL, HFL અમદાવાદ કોમર્સ હાઉસ, ચોથો માળ, કોમર્સ હાઉસ-૪, શૈલ પેટ્રોલ પંપની પાસે, આનંદનગર રોડ, પ્રહલાદનગર, અમદાવાદ-૩૮૦૦૫૧ **કોપરિટ ઓક્સિ**ઃ આઇઆઇએકએલ ટાવર પ્લોટ નં.૯૮, ઉદ્યોગ વિહાર, ફેસ-૪, ગુરગાંવ, હરીયાણા સંપર્ક કરવા

સહી/- અધિકૃત અધિકારી, IIFL હોમ ફાઇનાન્સ લીમીટે

સાવાકા બિઝનેસ મશીન્સ લિમિટેડ

રજીસ્ટર્ડ કચેરી : ૪૫, ચીનુભાઈ ટાવર, હેન્ડલુમ હાઉસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯,

આથી નોટીસ આપવામાં આવે છે કે, કંપનીની ૨૮ મી (૨૮) વાર્ષિક સામાન્ય સભા (" એજીએમ ") તા.: ગુરુવાર, ૨૫ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ બપોરે ૦૧.૦૦ કલાકે વિડિયો કોન્ફરસિંગ (વીસી) / અન્ય ઓડિઓ વિઝયુલ સાંધનો (ઓએવીએમ) મારફત વાર્ષિક સામાન્ય સભાની નોટીસમાં જણાવેલ કામો માટે મળશે.

COVID – ૧૯ ની મહામારીનો વ્યાપ હજી પણ ચાલુ હોવાથી, કોર્પોરેટ એફર્સ મંત્રાલયે તેઓના પરિપત્ર નં. : ૨૦ ૨૦૨૦ તા. : ૫, મે, ૨૦૨૦, ને પરિપત્ર નં. : ૧૪ ૧ ૨૦૨૦, ૧૭ ૧ ૨૦૨૦, ૦૨ / ૨૦૨૧, ૧૯ / ૨૦૨૧ અને ૦૨ / ૨૦૨૨, અનુક્રમે તારીખ ૮, એપ્રિલ, ૨૦૨૦, ૧૩, એપ્રિલ, ૨૦૨૦, ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧, ૮, ડીસેમ્બર, ૨૦૨૧ અને ૫, મે, ૨૦૨૨, (જેનો ઉલ્લેખ સંયુક્ત રીતે હવે પછી એમસીએ પરિપત્ર તરીકે કરવામાં આવશે.) સાથે વંચાણે લઈ અને કંપની અધિનિયમ, ૨૦૧૩ ની સબંધિત જોગવાઇઓ અને સેબી (લિસ્ટિંગ બાબતની જવાબદારીઓ અને સ્પષ્ટતાઓ) અધિનિયમ, ૨૦૧૫ ના અનુપાલનને આધીન વાર્ષિક સામાન્ય સભા વીસી ઓએવીએમ મારફત યોજવામાં આવશે.

કંપનીએ એજીએમની નોટીસ, જે સભ્યોના ઇમેલ એડ્રેસ કંપની ડિપોઝિટરી પાસે નોંધાયેલ હોય તેઓને ઇલેક્ટોનિક મોડ મારફત તા. દૃ, સપ્ટેમ્બરના રોજ, કોર્પોરેટ એફર્સ મંત્રાલયના ઉપરોક્ત જણાવેલ પરીપત્રો મુજબ અને સેબી મારફત જારી કરવામાં આવેલ પરિપત્ર નં. : સેબી / એચઓ / સીએફડી / સીએમડી૧ / સીઆઇઆ૨ / પી / ૨૦૨૦ ૭૯, તા. ૧૨, મે, ૨૦૨૦, સેબી , એચઓ / સીએફડી / સીએમડીર / સીઆઇઆર / પી / ૨૦૨૧ / ૧૧, તા.૧૫, જાન્યુઆરી, ૨૦૨૧ અને સેબી / એચઓ , સીએફડી / સીએમડીર / સીઆઇઆર / પી ૨૦૨૦ / ૬૨, તા. ૧૩, મે, ૨૦૨૨ (જેનો ઉલ્લેખ સંયુક્ત રીતે હવે પછી સેબી પરીપત્રો તરીકે કરવામાં આવશે.) સભ્યોએ ધ્યાને લેવા જોગ છે, કે નોટીસ અને નાણાકીય રિપોર્ટ ૨૦૨૦ – ૨૦૨૧, કંપનીની વેબસાઇટ www.sawacabusiness.com, સ્ટોક એક્સ્ચેંજ, બોમ્બે સ્ટોક એસ્ટેજ લિ.ની વેબસાઇટ www.bseindia.com અને સીડીએસએલની વેબસાઇટ WWW.evotingindia.com ઉપર પણ ઉપલબ્ધ છે. સભાસદો માત્ર વીસી / ઓએવીએમ દ્વારા જ સભામાં હાજરી આપી શકશે અને ભાગ લઈ શકશે. સભામાં ભાગ લેવા માટેની સૂચનાઓ એજીએમની નોટીસમાં જણાવવામાં આવેલ છે. વીસી / ઓએવીએમ દ્વારા સભામાં ભાગ લઈ રહેલા સભાસદોની ગણતરી કંપની અધિનિયમ, ૨૦૧૩ ની ક્લમ – ૧૦૩ હેઠળ કોરમના હેતુસર કરવામાં આવશે.

કંપની સભાસદોને એજુએમની નોટીસમાં જણાવેલા તમામ કાર્યો બાબતે વોટ આપવા માટે રિમોટ- ઈ -વોટિંગ સુવિધા (રિમોટ – ઈ – વોટિંગ) પૂર્ટી પાડી રહી છે. સભાસદો આ રિમોટ – ઈ – વોટિંગની સુવિધાનો અથવા ઈ – વોટિંગ સુવિધાનો . ઉપયોગ કરીને સભાના કોઈપણ કાર્ચ બાબતે પોતાનો વોટ એજીએમ દરમ્યાન આપી શકશે. એજીએમ દરમ્યાન રિમોટ – ઈ વોટિંગ / ઈ – વોટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા એજીએમ નોટીસમાં જણાવવામાં આવેલ છે.

જો તમે હજી સુધી તમારું ઈ–મેઇલ એડ્રેસ કંપની/ડિપોઝિટરી પાસે રજિસ્ટર્ડ કરાવ્યું ન હોય, તો વાર્ષિક રિપોર્ટ અને ઈ–વોટિંગ માટેની લૉગ ઇન વિગતો ઈ–મેઇલ એડ્રેસ દ્વારા મેળવવા માટે માટે કૂપા કરી નીચે આપવામાં આવેલ સૂચનાઓને અનુસરો.

જે સભાસદો ભૌતિક રવરૂપે શેર ધરાવતા હોય તેઓએ તેમનો ફોલીયો નં.અને સેલ્ફ એટેસ્ટેડ પાન કાર્ડ નકલ સાથે માટે

તમારા ડીપોઝીટરી પાર્ટીસીપેન્ટ (DP) નો સંપર્ક કરો અને ડીપીની સૂચના મુજબની પ્રક્રિયા દ્વારા તમારું ઈ-મેઈલ એડ્રેસ તમારા ડીમેટ એકાઉન્ટમાં નોંધાવો. સ્થળ : અમદાવાદ.

Notice is also hereby given that, pursuant to Section 91 and other applicable provisions, if any of the Companies Act, 2013 and as per SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulation, 2015, that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday 20th August, 2022 to Saturday 27th August, 2022 (both days inclusive) for the purpose of 30thAnnual General Meeting (AGM). The Member who have cast their vote through remote e-voting prior to the AGM may also participate the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their vote again through e-voting facilities available during the AGM.

PAN and AADHAR Card for registering email ID

account as per the process advised by your DP

Once the Member cast vote on a resolution, the Membershall not be allowed to change it subsequently detailed instructions for remote e-voting joining the AGM and e-voting during the AGM is provided in the Notice of 30th AGM.

Pursuant to the provisions of Section 108of the Companies Act, 2013, read with Rules framed thereunder and as per SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide remote e-voting facility to its members to exercise their rights to vote electronically on all resolutions set forth in the Notice convening the 30th Annual General Meeting. The Notice is displayed on the Website of the Company www.unickfix-a-form.com and also on the website of BSE at https://www.bseindia.com/stockshare-price/unick-fix-a-form-and-printers-ltd/unick/541503/

The company has engaged in the services of Central Depository Services (India) Limited (CDSL) to provide e-voting facility to its members. The company has appointed M/s. Vishakha Agrawal & Associates., Practicing Company Secretaries, Indoré to act as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.

The remote e-voting facility will be available during the following voting period:-The date and time of Commencement of E-Voting-Wednesday, 24th August, 2022 at 9:00

The date and time of End of E-Voting- Friday, 26th August, 2022 at 5:00 P.M. During this period, members of the company, holding shares either in physical form or in dematerialized form as on the cutoff date (19th August 2022) may cast their vote electronically.

The result of the voting will be declared within 48 hours from the conclusion of AGM i.e. on or before 29th August, 2022 and results so declared along with the Scrutnizer Report will be placed on the website of the company and BSE website.

In case of you have any of queries or issues regarding e-voting write an email to helpdesk.evoting@cdsl.com call on Toll free no. 1800 22 5533 or contact our RTA Big Share Services Pvt Ltd A/802, Samudra Complex, Near Klassic Gold Hotel, Girish Cold Drink, Off C.G. Road Navrangpura, Ahemdabad- 380009 Tel No. 079-40024135 email bssahd3@bigshareonline.com

> BY ORDER OF THE BOARD FOR UNICK FIX-A-FORM & PRINTERS LTD Sd/- BhupenNavnit Vasa Managing Director

DIN: 00150585

મુજબ પારદર્શક અને ન્યાયી બનાવવા મથતા હોય છે. આવા પધ્ધતિએ પસંદ કર્યા હતાં. ધરતીરત્નોને પુરસ્કૃત કરી સમાજને રાહ ચીંધવાના કાર્યને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આયોજીત કરવામાં આવે છે કે જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે.

નિર્ણય લેવો.

જણાવ્યું હતું કે, માનવસેવાના કાર્યોની જરૂરિયાત દરિયા જેટલી

ઉપાર્જનની અપેક્ષા સિવાય માનવસેવા કે સમાજસેવા કરે છે તેવા ધરતી રત્નોને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી નવાજવાનો અમારા અભિગમનો મુખ્ય હેતુ દીવે-દીવો પ્રગટે તેમ અનેક સેવકોને ઉત્તમ સેવાકાર્યો કરવાની પ્રેરણા મળે તેનો છે. સીએ આર એસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ધરતી રત્ન એવોર્ડ માટે કુલ ૭૯ નોમીનેશન આવ્યા હતાં, જેમાંથી કુલ ૬૫ નોમીનેશન માન્ય હતાં. આ ૬૫ નોમીનેશનમાંથી કુલ ૧૧ ધરતી રત્નોને અમારી પસંદગી સમિતિના અધ્યક્ષ જસ્ટીસ એસ. એમ. સોની (પૂર્વ જસ્ટીસ, ગુજરાત હાઈકોર્ટ) જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને સેન્ટર ફોર એન્વાર્યમેન્ટ્ર એજ્યુકેશનુના ફાઉન્ડર કાર્તિકેય વિ. સારાભાઈએ અલગ-અલગ સેવાકીય કેટેગરી

લેસ્ટર્ન ટાઇસ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી

-જાહેરખબર મેનેજર

જોડી કંપનીને તેના ઇમેઇલ એડ્રેસ sawacabusiness@yahoo.com અથવા કંપની રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ બીગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડની વેબસાઈટ www.bigshareonline.comન ઉપર મોક્લી તેન અપડેટ/ નોંધણી કરાવવા વિનંતી છે.

વતી, સાવાકા બિઝનેસ મશીન્સ લિમિટેડ સહી (શેતલ શાહ) DIN: 02148909, મેનેજીંગ ડિરેક્ટર તારીખ : 09/0८/૨૦૨૨